

જમીન પાણી અને ગોણા તત્ત્વો

પ્રશ્ન : પાકના પોખણ માટે જરૂરી પોખક તત્ત્વો કેટલા છે અને કયા કયા છે?

જવાબ : છોડનું રાસાયનિક પૃથ્વીકરણ ઉપરથી જણાયું છે કે તેમાં લગભગ ૫૦ થી ૫૧ વધુ તત્ત્વો સમાવેલા છે. આ બધાજ તત્ત્વો છોડની વૃદ્ધિ અને જૈવ રાસાયનિક પ્રક્રિયાઓ માટે જરૂરી નથી. સંશોધન દવારા આપણે જાણી શક્યા છીએ કે છોડને તેના પોખણ અને વૃદ્ધિ માટે ૧૫થી ૧૭ તત્ત્વોની જ જરૂરીયાત રહે છે. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશીયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરીયાત હોવાથી તેને મુખ્ય પોખક તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેલ્શીયમ, મેનેશીયમ અને ગંધકને ગોણા તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે બાકીના સાત થી આઠ તત્ત્વો જેવાકે આયર્ન (લોહ), મેગનીઝ, જીક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલીબ્દેડમ, કલોરીન અને સોડિયમ તત્ત્વો અદ્ય અથવા ઓછા કે નહિવત પ્રમાણમાં હોવાથી આ જુથના તત્ત્વો સુધ્ય તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કાર્બન, હાઈટ્રોજન અને ઓક્સિજન છોડ હવા અને પાણીમાં મેળવે છે.

પ્રશ્ન : જમીનનો નમુનો કેવી રીતે લેવો અને તેનું પૃથ્વીકરણ કયાં કરાવતુ?

જવાબ : બધાજ ખેતરો એક્સરખા સમતલ તેમજ એક સરખી ફળદૂપતાવાળા હોતા નથી એટલે પૃથ્વીકરણ માટેનો નમુનો યોગ્ય રીતે લેવાય તે ઘણું અગત્યાનું છે.

૧. દર બે હેકટરે જમીનના ખેતરમાથી એક મીશ્ર નમુનો ૧૦ થી ૧૨ જગ્યાએથી લેવો જોઈએ.
૨. જમીનનો નમુનો લેવા માટે જમીન (પાસ) ને દુર કર્યા રીવાય ઉપરથી ઘાસ, કાકરા, કચરો સાફ કરી અને કોદાળી કે ખૂરથી વડે વી આકારનો ૧૫ થી ૨૦ સેમી ઊડો ખાડો કરવો, ખાડાની એક બાજુએથી ૨ થી ૫ સેમી જેટલી ઉપરથી નીચે સુધી એક જાડાઈની માટી એકઠી કરવી. આમ ૮ થી ૧૦ સ્થળેથી નમુનો લઈ બધી માટી ભેગી કરી, સારી રીતે મીશ્રણ કરવું.
૩. જો માટી ભીની હોય તો જાડના છાયા નીચે સુકવી અને ત્યારબાદ બધીજ માટીને એક બક્કિયામાં ભરવી અને તેને સરખી પાથરી તેના ચાર સરખા ભાગ પાડવા. તેમાથી સામ સામેના બે ભાગની માટી એકત્રીત કરી ઉપર મુજબ એક ડિલોગ્રામ રહે ત્યાં સુધી પુનરાવર્તન કરવું.
૪. આ રીતે તૈયાર કરેલ જમીનનો નમુનો પોલીથીલીનની બેગમાં ભરી અને બેગને કાપડની બેગમાં મુકી પૃથ્વીકરણ કરવા માટે તૈયાર કરવો. આ રીતે દરેક ખંડ માટે અલગ નમુના તૈયાર કરવા.
૫. જમીનની સ્થિતી અને પ્રકાર મુજબ નમુનો લેવાના યોગ્ય સાધન (ઓગર) ની પસંદગી કરવી જોઈએ. સામાન્ય રીતે કોશ, કોદાળી, જીકમ જેવા સાધનો પણ ઉપયોગમાં લઈ શકાય.

૬. નમુનાની બેગ પર ખેડુતનું નામ—સરનામું, સર્વે નંબર, નમુના લીધાની તારીખ અને સર્વે નંબર જેવી વિગત આપવી.

જમીનની ચકાસણી ખેતીવાડી ખાતા હસ્તકની દરેક જીલ્લામાં જીલ્લા મથકે આવેલ જમીન ચકાસણી પ્રયોગશાળા, કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કૃષિ રસાયણ અને જમીન વિજ્ઞાન વિભાગમાં ઉપરાંત જી. એસ. એફ. સી. અને ઈફકો ક્રુ. હસ્તકની પ્રયોગશાળામાં થઈ શકે છે.

પ્રશ્ન : ખેતીમાં ચિયત પાણીની ગુણવત્તા માટે નમુનો કેવી રીતે લેવો?

જવાબ : સામાન્ય રીતે પાણીનો નમુનો અધ્યથી એક લીટર પાણી સમાય શકે તેવી કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં લેવા, બોટલ બરાબર સાફ કર્યા પછીજ તેમાં પાણીનો નમુનો લેવો અને નમુનાના પાણીથી બે થી ત્રણ વખત બોટલ ધોઈ અને પછી જ નમુનાનું પાણી બરવું.

જો કુવા ઉપર ઈલેક્ટ્રિક મોટર ન હોય ત્યારે પાણીનો નમુનો ડોલને દોરડાથી કુવામાં ઉતારી ત્યારબાદ પાણીમાં ૧૦ થી ૧૫ કૂટ ઉંદે જવા દેવી. ત્યારબાદ પાણીની ભરેલી ડોલ કુવા બરાબર કાઢી અને કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી દેવું. ત્યારબાદ બોટલને બરાબર બુચ મારી પેક કરવી. અને તેના ઉપર ખેડુતનું નામ—સરનામું, નમુનો લીધાની તારીખ અને બોર—કુવાની ઊંડાઈ વગેરે માહિતી પત્રક ચોટાડવું.

પ્રશ્ન : મગફળી પીળી પડવાના કારણો કયાં—કયાં હોય છે

જવાબ : મગફળી પીળી પડવાના કારણોમાં જમીનનું ધોવાણ, રેચક જમીન, જમીન અને પાણીની ખારાશ, લભ્ય પોષક તત્વો જેવાકે નાઈટ્રોજન, ગંધક અને લોહતત્વની ઉષાપ હોય છે. આ ઉપરાંત રોગ—જીવાતનાં વધુ ઉપદ્રવથી પણ મગફળી પીળી પડે છે.

પ્રશ્ન: લોહતત્વની ઉષાપને લીધે મગફળી પીળી કયારે પડે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે થાય છે?

જવાબ : સૌરાષ્ટ્રમાં મગફળી વાવેતર વિસ્તારની જમીન મુખ્યત્વે મધ્યમ કાળી ચુનાવાળી છે તેથી મગફળીનાં શરૂઆતના સમયગાળા દરમ્યાન લોહતત્વની ખામીને લીધે પીળાશ જોવા મળે છે તેના ચિનહ્યેમાં મુખ્યત્વે મગફળીનાં ટોચનાં વિકસતા કુમળા પાન પહેલા પીળા થાય છે ત્યારબાદ આ પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. સામાન્ય રીતે નીચેના ઘરડા પાન લીલા દેખાય છે જો કે આ પીળાશ ખેતરમાં એકસરખી ન હોઈ, છુટક છુટક ધાખામાં સવિશેષ જોવા મળે છે.

મગફળીમાં લોહતત્વની ખામીને કારણો આવતી પીળાશ ફુર કરવા માટે ૧૦૦ ગ્રામ દીરાકસી તથા ૧૦ ગ્રામ લીલુનાં ફુલ (સાઈટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાને રાખી પ્રતિ વીધે ૩૦ થી ૫૦ લીટર દ્રાવણ ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવાથી પીળાશ કાબુમાં આવે છે.

પ્રશ્ન: કારીય જમીનો કેટલા પ્રકારની હોય છે?

જવાબ: કારીય જમીનો મુખ્ય ત્રણ પ્રકારની છે.

૧. ખારી જમીન:- જેમાં દ્રાવ્ય કારોનું પ્રમાણ વધારે એટલે કે જમીનના સંતૃપ્ત દ્રાવણની વિદ્યુતવાહકતા ૪ ટે.સા./ મી. કરતા વધારે હોય છે અને વિનીમય પામતા સોડિયમનું પ્રમાણ ૧૫ ટકા કરતા ઓછું હોય છે અને પી. એચ. ૮.૫ કરતા નીચો હોય છે.

૨. ભાષ્મિક જમીન:- જેમાં દ્રાવ્યક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ વિનીમય પામતા સોડિયમનું પ્રમાણ ૧૫ ટકા કરતા વધારે હોય છે. પી. એચ. આંક હંમેશા ૮.૫ કરતા વધારે હોય છે.

૩. ખારી-ભાષ્મિક જમીન:- જે જમીનના સંતૃપ્ત દ્રાવણની વિદ્યુતવાહકતા ૪ ટે.સા./મી. કરતા વધુ તેમજ વિનીમય પામતા સોડિયમનું પ્રમાણ ૧૫ ટકા કરતા વધારે હોય છે. જમીનનો પી. એચ. આંક ૮.૫ કરતા વધારે હોય છે.

પ્રશ્ન : ખેતરની જગીન ખારી છે કે ભાષ્મિક તે કેવી રીતે જાણી શકાય છે?

જવાબ : જગીન ખારી છે કે ભાષ્મિક તેનો ખરેખર ઘ્યાલ તો તેના પૃથ્યકરણ પરથી જાણી શકાય છે. પરંતુ કેટલીકવાર જગીનના અવલોકન પરથી અંદાજીત ઘ્યાલ આવી શકે છે જેમકે ખારી જગીનની સપાઠી પર સફેદ કારોનું પડ જોવા મળે છે. તેમજ જગીન પોચી ભરભરી અને લુણો લાગ્યો હોય તેવી જણાય છે અને પાણી સહેલાઈથી નીતરી જાય છે જ્યારે ભાષ્મિક જગીનની સપાઠી ઉપર કાળી કે બદામી રંગની છારી જણાય છે. આથી જગીન ભીની થતા ચીકળી લાગે છે અને સુકાતા કઠણ બની જાય છે તેમજ જગીનમાં પાણી જલદી નીતરી શક્તું નથી. પરિણામે જગીન પર પાણી ભરાઈ રહે છે.

પ્રશ્ન : ખારી જગીન સુધારવા શું કરવું જોઈએ?

જવાબ: ખારી જગીન સુધારવા માટે જગીન સુધારકોની જરૂર પડતી નથી, પરંતુ આવી જગીનોમાં દ્રાવ્ય કારોનું પ્રમાણ વધુ હોવાથી આ કારોને વૈજ્ઞાનિક પદ્ધતિથી અગાર મેનેજમેન્ટ પદ્ધતિઓ દવારા ઓછા કરવામાં આવે તો જગીન સુધારી શકાય છે. આવી જગીનમાં મીહું પાણી એટલેકે વરસાદનું પાણી અથવા નહેરનું પાણી ખેતરની ચારે બાજુ પાળા બાંધી ભરી રાખવાથી જગીનના દ્રાવ્ય કારો પાણીમાં દ્રાવ્ય થઈ નિતાર વાટે નીચે જવાથી જગીન સુધારી શકાય છે. આવી જગીનમાં નિતારશક્કિત ઝડપી બને તે માટે જગીનમાં ઉડી ખેડ કરવી, સેન્ટ્રિય ખાતરનો ઉપયોગ કરવો તેમજ ટાંચ અગાર રેતી ઉમેરવી ખૂબજ આવશ્યક છે. જેથી નીતાર વાટે દ્રાવ્ય કારો જલ્દીથી વહન થઈ નીચે ચાલ્યા જાય.

પ્રશ્ન: ભાષ્મિક જગીન સુધારવા શું કરવું જોઈએ?

જવાબ : આવી જગીનમાં દ્રાવ્યક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ વિનીમય પામતા સોડિયમનું પ્રમાણ

વધુ હોવાથી મારીનાં રજકણો એકબીજાથી છુટા પડી જવાથી જમીનનો બાંધો તુટી જાય છે. આવી જમીનો સુકાતા કઠણ બની જાય છે. ભાષ્યિક જમીનને સુધારવા વધુ પડતા સોડિયમને દુર કરવા માટે જમીન સુધારક તરીકે જીપ્સમનો ઉપયોગ કરી ત્યારબાદ મીઠા પાણીથી જમીનમાં શારો દુર કરવા જોઈએ.

પ્રશ્ન : રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવા કયા કયા પગલા લઈ શકાય?

- જવાબ :**
૧. ખાતરો જમીનમાં ઓગળે પછીજ મુળ દવારા છોડ તેનું શોખજા કરે છે એટલે વધુમાં વધુ ખાતરોનું છોડ શોખજા કરે તે માટે જમીનમાં પુરતો બેજ જાળવી રાખવો જરૂરી છે.
 ૨. જમીનમાં નાખેલા ખાતરો વરસાદથી ઘોવાઈ ન જાય તે માટે જમીન સમતલ બનાવી પાળ બાંધો.
 ૩. સેન્ટ્રિય ખાતરો, જૈવિક ખાતરો અને રાસાયણિક ખાતરોનો સંકલીત ઉપયોગ કરવો. આ નણે ખાતરો એકબીજાનાં પૂરક છે હરીફ નથી કે વિકલ્પ પણ નથી.
 ૪. નાઈટ્રોજનયુક્ત ખાતરો હપ્તેથી તેમજ ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો એકજ હપ્તે વાવણી / રોપણી વખતે જ આપવા.
 ૫. ખેતરમાં છોડની પુરતી સંખ્યા જાળવો, નિદંશ દુર કરવા અને રોગ-જીવાત સામે સમયસર જરૂરી પગલા લેવા.

પ્રશ્ન : રાસાયણિક ખાતરોની ઓળખ આપો.

જવાબ : રાસાયણિક ખાતરોની સામાન્ય ઓળખ બે રીતે થઈ શકે

૧. તત્વના નામ ઉપરથી જેમકે નાઈટ્રોજનયુક્ત ખાતરો ફક્ત નાઈટ્રોજન તત્વ ધરાવતા હોય છે. દા.ત. યુરીયા, એમોનીયમ સલ્ફેટ, ફોસ્ફરસયુક્ત ખાતરો ફક્ત ફોસ્ફરસ ધરાવે છે. દા.ત. સિંગલ સુપર ફોસ્ફેટ, ડી.એ.પી., પોટાશયુક્ત ખાતરો પોટાશ ધરાવે છે. દા.ત. ભ્યુરેટ ઓફ પોટાશ, સલ્ફેટ ઓફ પોટાશ અને ગંધકયુક્ત ખાતરો ગંધક ધરાવે છે. દા.ત. ગંધક, જીપ્સમ, લાઈભ સલ્ફર.

૨. ખાતરમાં રહેલ તત્વ કે તત્વનાં સમુહો અને તેની માત્રા મુજબ નણ રીતે ઓળખવામાં આવે છે.

અ. સીધા સાદા ખાતરો:- આ પ્રકારનાં ખાતરોમાં ફક્ત એકજ તત્વ નિશ્ચિયત માત્રામાં હોય છે. દા.ત. યુરીયા, સિંગલ સુપર ફોસ્ફેટ, ભ્યુરેટ ઓફ પોટાશ.

બ. સંયોજીત ખાતરો:- આ પ્રકારનાં ખાતરોમાં ચોકક્સ માત્રામાં બે તત્વો રહેલા હોય છે.

દા.ત. ડી.એ.પી. જેમા ૧૮ ટકા નાઈટ્રોજન અને ૪૮ ટકા ફોસ્ફરસ હોય છે.

ક. મિશ્ર ખાતરો:- આ પ્રકારનાં ખાતરોમાં નિયત માત્રામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ,

પોટેશીયમ પૈકી બે કે તેથી વધુ તત્વો હોય છે. દા.ત. સુફ્લા ૨૦: ૨૦:૦ કે ૧૫:૧૫: ૧૫
વગેરે અને ઈફ્કો ગ્રેડમાં ૧૨:૭૨:૧૫ મુખ્ય છે.

પ્રશ્ન: જૈવિક ખાતરો એટલે શું અને તેની અગત્યતા જણાવશો.

જવાબ : આપણે જૈવિક ખાતરોની વાત કરીએ તો જમીનમાં રહેલા અસંખ્ય સુક્ષ્મજીવાણું ઓ જમીનની ફળદુપતા અને ઉત્પાદકતા ટકાવી રાખવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. સુક્ષ્મજીવાણું ઓ હવામાનો મુક્ત નાઈટ્રોજન જમીનમાં લભ્યરૂપે સ્થિર કરવાની, જમીનમાં રહેલા અદ્ભુત ફોસ્ફરસને લભ્યરૂપમાં લાવવાની તેમજ જમીનમાં ઉમેરતા પાકનાં અવશેષોનું વિઘટન કરવાની શક્તિ ધરાવે છે અને આડકતરી રીતે જમીનની ફળદુપતા અને સેન્ટ્રિયતા વધારી છોડનાં વૃદ્ધિ-વિકાસ અને પાક ઉત્પાદનમાં વધારો કરે છે. આમ, આ પ્રકારનું ખાતર કે જે સુક્ષ્મજીવાણું દવારા બને છે તેને જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે.

બજારમાં મળતા જૈવિક ખાતરોમાં કઠોળ પાકો એટલે મગફળી, મગ, ચણા અડદ, તુવેર, ચોળા વગેરે માટે રાઈઝોબીયમ કલ્યર, ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ અને ઘઉં તેમજ શાકલાજી, કપાસ અને શેરડીનાં પાકો માટે એઝોટોબેક્ટર અને એઝોસ્પાઈરીલમ કલ્યર, જમીનમાના અદ્ભુત ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવતું ફોસ્ફોબેક્ટેરીયમ કલ્યર ઉપરાત એઝોલા કે જેનો ઉપયોગ ઘઉં, બટાટા અને ડાંગરના પાકમાં કરી શકાય તેમજ જલ્યુ ગ્રીન આલ્ગીનો ઉપયોગ ડાંગરના પાકમાં કરવામાં આવે છે. કલ્યરનાં ઉપયોગ સમયે જમીનમાં ભેજ હોવો જરૂરી છે તેમજ કલ્યર બનાવ્યા પછીનો સમયગાળો પણ ધ્યાનમાં રાખવો પડે છે.

પ્રશ્ન : ખારા પાણીથી ખેતીમાં કઈ—કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

જવાબ : જો કે ખારા પાણીની સુધારણા કરવી વ્યાવહારીક શક્ય નથી તેમ છતા ખારા પાણીમાં મીહું પાણી મિશ્ર કરી વપરાશમાં લઈ શકાય છે. અથવા તો બે થી ત્રણ ખારા પાણીનાં પિયત પછી એકાદ પિયત મીઠા પાણીનું આપી ઉપયોગમાં લઈ શકાય.

જ્યારે ભાષ્યિક પાણીની સુધારણા યોગ્ય રાસાયણિક સુધારકો જેવા કે જીપ્સમ (ચીરોડી), ક્રેલ્શીયમ કલોરાઈડ, હીરાકસી વગેરે જરૂરીયાત પ્રમાણે પિયતના પાણીમાં કે પછી પિયતની જમીનમાં ઉમેરવાથી આવા પાણીની માઠી અસર નિવારી શકાય છે.

૧. ખારા પાણીના વપરાશ માટે જમીન વ્યવસ્થા:

- (૧) જમીનની વારંવાર ચકાસણી કરવી
- (૨) જમીનમાં અવાર નવાર છાણીયું ખાતર ઉમેરતા રહેવું અથવા દર ત્રણ વર્ષે એક લીલો—પડવાશ કરવો.
- (૩) જમીન સમતળ કરી બંધપાળા બાંધવા જેથી વરસાદનું પાણી ભરાઈ રહેતા ક્ષારો નીચે ઉતરી જશે.

(૪) મારીયાળ પોતવાળી જમીનમાં ઉડી ખેડ કરવી, ટાંચ ઉમેરવી.

૨. ખારા પાણીના વપરાશ માટે પાક વ્યવસ્થા:

- (૧) બીજનો દર સવાયો રાખવો.
- (૨) ક્ષાર સહનશીલ, ટુંકાગાળાના અને ઓછા પાણીની જરૂરીયાત વાળા પાક વાવવા.
ક્ષાર સહનશીલ પાકની પસંદગી નીચે મુજબ કરવી.
- (૩) ખેતીપાકો:- ઘઉ, કસુંબી, સરસવ, કપાસ, રાયડો અને દિવેલા.
- (૪) શાકભાજી:- બીટ, પાલક, કોણીફલાવર, ટ્યેટા, હુંગણી, ગાજર
- (૫) ઘાંસચારો:- ઘરો, ઝીંગવો, પેરાધાસ, કર્ણલધાસ, બ્યુયનીકધાસ
- (૬) બાગાયત પાકો:- ખારેક, દાડમ, ચીકુ, નાળીચેર, જામફળ
- (૭) વન્ય પાકો:- પીલુડી, ગાંડા બાવળ, શરૂ, ખેર, મહુડો, નીલગીરી

૩. ખારા પાણીના વપરાશ માટે ખાતર વ્યવસ્થા:

- (૧) નાઈટ્રોજનયુક્ત ખાતર સવાયુ અને નજી હંતે આપવું.
- (૨) ખારી જમીનમાં યુરીયા અને સીગલ સુપર ફોસ્ફેટ આપવું.
- (૩) ભાષ્મિક જમીનમાં ડી.એ.પી. અથવા કેલ્શીયમ એમોનીયમ નાઈટ્રેટ આપવું.
- (૪) ભાષ્મિક પાણી હોય તો ડેકટરે રેપ કિલોગ્રામ લિંક સલ્ફેટ ઉમેરવું.

૪. ખારા પાણીના વપરાશ માટે પિયત વ્યવસ્થા:

- (૧) છિછરી જમીનમાં ટુંકાગાળે વધુ જથ્થામાં પિયત આપવું.
- (૨) ઉડી જમીનમાં ટુંકાગાળે ઓછા જથ્થામાં પિયત આપવું.
- (૩) બીજને કોરામાં વાવી ઉગ્યા પહેલા ભારે પિયત આપવું.
- (૪) નીકપાળામાં ઢોળાવ ઉપર વાવેતર કરવું.
- (૫) ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી.

પ્રશ્ન : સોઈલ હેલ્થ કાર્ડની અગત્યતા જણાવો.

જવાબ : સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડુતની જમીનની કુંડળી છે તેમાથી જમીન માલિક, જમીનનો પ્રકાર, જમીનનાં તત્ત્વોની લભ્યતા, જમીનની ફળદૃપતા અને જમીનમાં ખારાશ વિશેની માહિતી મળે છે. સોઈલ હેલ્થ કાર્ડ ખેડુતનાં હાથમાં આવવાથી કામ પુરુ થતું નથી પણ ત્યારબાદ જ ખરેખર કામ ચાલુ થાય છે. જમીનની તાસીરનો ખ્યાલ સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી આવે છે. ત્યારબાદ જમીનની જાળવણી, જે તે જમીનમાં પાકની જરૂરીયાત પ્રમાણે પોષકતત્વો, ખાતરોની પસંદગી, પાકની પસંદગી અને જમીન સુધારણા જેવી મહત્વની બાબતોનો ખ્યાલ આવે છે. આમ, સોઈલ હેલ્થ કાર્ડમાં આવેલ સમગ્ર પાસાઓને ધ્યાને રાખી સંશોધિત કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી સંપત્તિની જાળવણી સાથે ટકાઉ મહત્વમ કૃષિ ઉત્પાદન મેળવી શકાય.

સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા:

૧. જમીનમાં લલ્ય પોષકતત્ત્વોનાં પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષકતત્ત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષકતત્ત્વો ખાતરરૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયાં પાકમાં કેટલું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે તે નકકી કરી શકાય છે.
૨. વળી વખતો વખત આ જમીન ચકાસણીની પ્રક્રિયા થતી હોય, જમીનની ફળહુપતામાં કાલાંતરે થતા ફેરફારો પણ નજરમાં આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે.
૩. ખુબજ મહત્વની બાબત એ જમીનની ખારાશ છે. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખારાશનો અંદાજ આપવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોની ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
૪. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી આપાતી વિગતો જે તે ખેડુતને વ્યક્તિગત રીતે જ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા તેને જાળવી રાખો, ફરી જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પદ્ધતિ પ્રમાણે કાળજી પૂર્વક લેવડાવવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
૫. સૈથી મહત્વની બાબત એ છે કે સોઈલ હેલ્થ કાર્ડને કારણે ખેડુત, વિસ્તરણકાર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બન્યો છે કે જેમા માહિતીની આપ લે બન્ને બાજુ થઈ શકે છે. તેથી આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શક્યો છે.

પ્રશ્ન: ટાશ કેવી જમીનમાં, કેટલી અને ક્યારે નાખશો?

જવાબ : ટાશ કરાળ અને રેચ્ક જમીનમાં, જરૂરીયાત મુજબ હેકટરે ૫૦ થી ૧૦૦ ટન., ચોમાસામાં પહેલા ચાસમાં અથવા પાથરીને તેમજ દેશી ખાતર સાથે મિશ્ર કરીને આપી શકાય છે.

પ્રશ્ન: ખેતીમાં સુક્ષ્મતત્ત્વોનું મહત્વ જણાવો.

જવાબ: જે પોષકતત્ત્વોની છોડને દેહધાર્મિક ડિયાઓ માટે બહુજ ઓછી અગર સુક્ષ્મમાત્રામાં એટલે કે એક ભાગ પ્રતિ દસ લાખ ભાગ (પીપીએમ) કરતા પણ ઓછી માત્રામાં જરૂર પડતી હોય તેવા તત્ત્વોને સુક્ષ્મતત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. છોડને પોતાનો જીવનક્ષમ પુરો કરવા માટે અત્યાર સુધીમાં પ્રસ્થાપિત થયેલા ૧૬ આવશ્યક પોષકતત્ત્વો પૈકી લોહ, મેળોનીઝ, જસ્ત, તાંબુ, બોરોન, મોલીબ્ડેનમ અને કલોરીન, આ સાત સુક્ષ્મતત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ તત્ત્વોની છોડને સુક્ષ્મ પ્રમાણમાં જરૂરીયાત રહેતી હોવા છતા આવશ્યક તત્ત્વોની દ્રષ્ટિએ તેના મહત્વમાં કોઈ ફર પડતો નથી. પાક ઉત્પાદનમાં દિન પ્રતિદિન સુક્ષ્મતત્ત્વોનું મહત્વ વધતુ

જાય છે. કારણકે પાક ઉત્પાદન વધારવા માટે ઘનિષ્ઠ બેતી પદ્ધતિઓ અને સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ ઘટવાથી તેમજ વધુ ઉત્પાદન આપતી જાતોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાથી મુખ્ય પોષકતત્ત્વોની સાથે સાથે સુક્ષ્મતત્ત્વોનો પણ જમીનમાથી ઉપાડ વધવા લાગ્યો. મુખ્ય તત્ત્વો પુરા પાડવા માટે જે શુદ્ધ રાસાયનિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાં સુક્ષ્મતત્ત્વોનું પ્રમાણ નહિંવત હોય છે. પિયતની સગવડતાઓ વધવાથી એક જ જમીનમાથી બે થી ત્રણ પાકો લેવાથી પણ સુક્ષ્મતત્ત્વોનો ઉપાડ વધેલ અને જમીનમાં ખાતરરૂપે ન ઉમેરવામાં આવતા ધીરે ધીરે જુદા જુદા સુક્ષ્મતત્ત્વોની ઉણપ વર્તવા લાગી. જેના લીધે પાક ઉત્પાદન પર અસર જોવા મળે છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં હાલ જસ્ત અને લોહની ખામી જોવા મળે છે. આવી પરિસ્થિતીમાં જમીન-છોડનાં પૃથ્વેકરણ આધારે સુક્ષ્મતત્ત્વ ઘરાવતા ભલામજા મુજબનાં ખાતરો તેમજ સેન્દ્રિય ખાતર ઉમેરવાથી સુક્ષ્મતત્ત્વોની ઉણપનો પ્રશ્ન નિવારી શકાય.

પ્રશ્ન: જમીનમાં ખાતરો નાખતા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

જવાબ જમીન અને પાકનાં ગુણાધર્મો સાથે સુમેળ થાય તેવા વધુમાં વધુ માત્રામાં પાક શોષણ કરી ઉત્પાદનમાં રૂપાંતર કરે, અને એકમ તત્ત્વની કિમત પણ ઓછી હોય તેવા ખાતર પસંદ કરવા.

- ◆ જમીનની ફળદુપતા, જમીનની પ્રતિક્રિયા, ધોવાણ, પિયતની સગવડતા, અગાઉ ઉગાડેલ પાકની ઘનિષ્ઠતા, છોડની સંખ્યા, કઠોળ પાકનો સમાવેશ, છાણીયું અને અન્ય સેન્દ્રિય ખાતરોનો તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ, પાક અને પાકની જાત, તેમજ વાવળીનો સમય અને ઉત્પાદનની બજાર કિમત તેમજ આર્થિક બાબત લક્ષમાં રાખી યોગ્ય પ્રમાણમાં ખાતરો નાખવા.
- ◆ નાઈટ્રોજનયુક્ત ખાતરો એક કરતા વધારે હપ્તામાં તેમજ ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો એક જ હપ્તે વાવળી/રોપણી વખતે જ આપવા. તેમ છતા પોટાશ ખાતર પાકની જરૂરીયાત મુજબ અને જમીનનો પ્રકાર પ્રમાણે પૂર્તિખાતર તરીકે પણ આપી શકાય.
- ◆ ખાતરો શક્ય હોય ત્યાં સુધી ચાસમાં ભેજ સિથ્ટીમાં જમીનમાં સંપર્કમાં આવે તે રીતે મૂળ વિસ્તારમાં નાખવા, બીજ સાથે લેળવવા નહીં. ખાતરોને ફ્રીપ સાથે કે દ્રાવણ બનાવી પાંદડા ઉપર પંપથી છાંટીને આપી શકાય.
- ◆ ખાતરો એક બીજા સાથે પ્રતિક્રિયા કરી ભેજ ગ્રાલ્ફતા વધારે, નાઈટ્રોજનનો વાયુરૂપે વ્યય કરે, ફોસ્ફરસને અલાભ્ય રૂપમાં ફેરવી નાખે તેવા ખાતરો મિશ્ર કરાય નહીં. આ અંગે પ્રથમ જાણકારી મેળવવી.

પ્રશ્ન: ફાર્મિગેશન ઓટલે શુ? સમજાવો.

જવાબ : ટપક પદ્ધતિ અપાતા પાણી સાથે જ યોગ્ય પોષકતત્ત્વોના ખાતરોનું નિર્તયુ દ્રાવણ પાઈપમાં વહાવી ટીપે ટીપે આપવામાં આવે છે જેને ફાર્મિગેશન કહેવામાં આવે છે. અહીં છોડને ખાતરમાના

પોષકતત્ત્વો લભ્ય સ્વરૂપમાં સીધે સીધા મૂળ મારફતે રહે અને તેનો નિત્યારથી, હવામાં ઉડી જવાથી કે અવક્ષેપનથી વ્યય ઓછો થાય તે રીતે આપવાના રહે છે. વળી આ પદ્ધતિમાં જમીન-પાણી-છોડ વચ્ચેનો સંબંધ આદર્શ રીતે જળવાય રહેતો હોઈ આપવામા આવતા ખાતરના તત્ત્વો જમીન-પાણી-છોડમાં સહેલાઈથી ચલિત અવસ્થામાં ઉપસ્થિત રહે છે જેથી તેનું સહેલાઈથી અવશોષણ કરી શકે છે. નાઈટ્રોજનયુક્ત ખાતરોમાં યુરીયા અને લીકર એમોનીયમને, પોટાશયુક્ત ખાતરોમાં પોટેશીયમ કલોરાઈડ વગેરે આપી શકાય છે. આ ઉપરાંત સુષ્પાતત્ત્વો ધરાવતા ખાતરો-રસાયણો વાપરી શકાય છે. કારણકે તેની માત્રા ઘણીજ ઓછી હોય છે જેનું સહેલાઈથી નિત્ય દ્રાવણ બનાવી શકાય છે.